

ત્વરિત જાહેરાત માટે

બ્રેમ્પટન સીટી કાઉન્સિલે હેરિટેજ હાઈટ્સ કન્સેપ્ટ પ્લાનને સમર્થન આપ્યું

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (ઓગસ્ટ 7, 2020) – બ્રેમ્પટન સીટી કાઉન્સિલે બુધવાર, ઓગસ્ટ 5 નાં રોજ યોજાયેલી બેઠકમાં, બ્રેમ્પટનના છેલ્લાં અવિકસિત વિસ્તાર હેરિટેજ હાઈટ્સ માટેના કન્સેપ્ટ પ્લાનને સમર્થન આપ્યું.

4,000 એકરમાં ફેલાયેલો અને બ્રેમ્પટનના કુલ વિસ્તારના 1/16 જેટલા ભાગનું પ્રતિનિધિત્વ કરતો, હેરિટેજ હાઈટ્સ વિસ્તાર ઉત્તર-પશ્ચિમી બ્રેમ્પટનમાં આવેલો છે, જે મેક્લિડ રોડથી કેડિટ રીવર વેલી સુધી, અને વિન્સ્ટન ચર્ચિલ બુલેવોર્ડથી મિસિસાગા રોડ સુધી ફેલાયેલો છે. બ્રેમ્પટન 2040 વિઝનમાં દરખાસ્ત હેઠળના સ્થળને નવા ટાઉન સેન્ટર માટે – કામકાજના અને આવાસીય વિકલ્પો ધરાવતું એક સંપૂર્ણ, પૂર્ણ-સેવા, મિશ્રિત-ઉપયોગી સ્થળ તરીકે વિકસાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. હેરિટેજ હાઈટ્સ માટેનો કન્સેપ્ટ પ્લાન એક સમુદાય વસાવવા માટે શ્રેષ્ઠ વ્યવહારોને પ્રતિબિંબિત કરે છે જ્યાં ભાવિ રહેવાસીઓ અને નિયોક્તાઓ આરોગ્યપ્રદ જીવનશૈલી અને ઉચ્ચ ગુણવત્તાના જીવનનો આનંદ માણી શકે છે. તે વ્યાપક સમુદાય સામેલગીરી આધારિત છે, અને રહેવા, કામ કરવા, શીખવા અને રમતો રમવા માટે એક ટકાઉ, રહેવા યોગ્ય, ગતિશીલ, અને આરોગ્યપ્રદ સ્થળ છે.

બ્રેમ્પટન માટે સમર્થિત હેરિટેજ હાઈટ્સ કન્સેપ્ટ પ્લાન દ્વારા નોંધપાત્ર આવાસીય અને નોકરીઓમાં વૃદ્ધિની તકો ઊભી થાય છે. આ પ્લાનમાં દરખાસ્ત હેઠળનું GO સ્ટેશન અને પગદંડીઓ અને ખુલ્લી જગ્યાઓના સંયુક્ત નેટવર્ક સહિત, ઉચ્ચતર વર્ગના ટ્રાન્ઝિટની અનુકૂળ પહોંચ સાથે શ્રેણીબદ્ધ આવાસીય વિકલ્પો છે. હેરિટેજ હાઈટ્સ મારફતે દરખાસ્ત હેઠળના GTA પશ્ચિમ પરિવહન કોરિડોરની સામે, માત્ર ટૂકો માટે સમર્પિત એક લેન સહિત, આ પ્લાનમાં મધ્યસ્થ ઉત્તર/દક્ષિણ શહેરી મોટરવે છે. આ મુખ્ય બુલેવોર્ડ (વિશાળ માર્ગ) સમુદાય માટે એક શહેરી મિશ્રિત-ઉપયોગ તરીકે હાર્દ સમાન બનશે જ્યાં રહેવાસીઓ અને મુલાકાતીઓ ખરીદી કરી શકશે, સ્થાનિક રેસ્ટોરન્ટ્સનો આનંદ માણી શકશે, ધંધો શરૂ કરી શકશે અને આરોગ્યપ્રદ, સક્રિય અને ગતિશીલ જીવનશૈલીનો ભાગ બની શકશે. દરખાસ્ત હેઠળનું એક વેલનેસ ડિસ્ટ્રિક્ટ, જેમાં સંભવિત ભાવિ હોસ્પિટલ અને વધારાની તબીબી સહાયતા સેવાઓ માટે જમીનનો સમાવેશ થાય છે, મુખ્ય શહેરી મોટરવેની બાજુમાં સ્થિત છે. આ પ્લાનનું પરિણામ પર્યાવરણની દૃષ્ટિએ સૌથી અનુકૂળ રીતે કરવામાં આવનારા વિકાસથી એક સંપૂર્ણપણે જોડાયેલો, આધુનિક સમુદાયનું આવશે.

હેરિટેજ હાઈટ્સ બ્રેમ્પટન રહેવાસીઓના મૌલિક વિચારોને પ્રતિબિંબિત કરતું હોવાની ખાતરી કરાવવા, સીટી સંબંધિત હિતધારકો સાથે પોતાની વ્યાપક સાર્વજનિક સામેલગીરી પ્રક્રિયા ચાલુ રાખશે. સીટી અનિવાર્ય ટેકનિકલ અભ્યાસો પણ કરશે, અને સરકારના અન્ય સ્તરો સાથે ધનિષ્ઠપણે કામ કરશે, સુધારેલો આનુષંગિક (સેકન્ડરી) પ્લાન રાખવાના લક્ષ્ય સાથે, પ્રક્રિયાનો આગામી તબક્કો, વર્ષ 2020 નાં અંત સુધીમાં પૂરો થશે.

હેરિટેજ હાઈટ્સ અને આ વિસ્તાર માટે શહેરના આયોજન કાર્યક્રમ પર વધુ માહિતી માટે વેબસાઈટ જુઓ, www.brampton.ca/nwbrampton.

અવતરણો (ક્વોટ્સ):

“રહેવાસીઓને ઉચ્ચ ગુણવત્તાસભર જીવન જાળવવા દે તેવા સંપૂર્ણ, ટકાઉ અને જોડાયેલા સમુદાયો વસાવવા એ સીટી કાઉન્સિલ માટે અગ્રતા છે અને અમારા માટે તે બ્રેમ્પટન 2040 વિઝન હાંસલ કરવામાં મદદ મેળવવા અનિવાર્ય છે. બ્રેમ્પટનના છેલ્લાં અવિકસિત વિસ્તાર તરીકે, હેરિટેજ હાઈટ્સને શરૂઆતથી યોગ્ય બનાવવા એક રોમાંચક તક મળી છે. મને વિશ્વાસ છે કે આ કન્સેપ્ટ પ્લાન બિલકુલ તે જ કરશે, નોકરીઓ લાવશે, પરવડતા આવાસો અને ઉત્તર-પશ્ચિમી બ્રેમ્પટનમાં રહેવાની, કામ કરવાની, શીખવાની અને રમતો રમવાની તક પૂરી પાડશે.”

- પેટ્રિક બ્રાઉન (Patrick Brown), મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

“સીટીએ સમગ્ર બ્રેમ્પટનમાંથી દરેક અનુભવ અને પર્યાટનભૂ ધરાવતા રહેવાસીનું કિમતી મંતવ્ય જાણ્યું અને તે અનિવાર્ય સહયોગ હેરિટેજ હાઈટ્સના કન્સેપ્ટ પ્લાનમાં ચોક્કસપણે પ્રતિબિંબિત થાય છે. 2040 વિઝન અમે જે રીતે આયોજન કરીએ છીએ તેમાં ખરેખરો ફેરફાર લાવી રહ્યું છે, જેમાં તમામ વિકાસને એક સંપૂર્ણના ભાગ તરીકે જોવાનો સમાવેશ થાય છે. આ હેરિટેજ હાઈટ્સ પ્લાન આ લક્ષ્યો હાંસલ કરવામાં એક મહત્વપૂર્ણ ભાગ છે અને તેને સમર્થન આપવામાં હું ગૌરવ અનુભવું છું.”

- માર્ટિન મેડેઈરોસ (Martin Medeiros), રીજીયનલ કાઉન્સિલર, વોર્ડ્સ 3 અને 4; પ્રમુખ, આયોજન અને વિકાસ સમિતિ, સીટી ઓફ બ્રેમ્પટન

“હેરિટેજ હાઈટ્સ ભવિષ્યને ધ્યાનમાં લેતી, વિચારશીલ અને સુંદર સમુદાય વિકસાવવાની એક અજોડ તક છે જેનું ગૌરવ બધાં બ્રેમ્પટનવાસીઓ અનુભવી શકે છે. અમે જાહેર જનતા અને ઊર્જાવાન હિતધારકોને એકસરખા પ્રવૃત્તમય રાખવાનું ચાલુ રાખીએ છીએ ત્યારે, અમે તેઓના જુરસાભર્યા અને આશ્ચર્યચકિત ક્ષણા બદલ આભારી છીએ. બ્રેમ્પટનના લોકો શ્રેષ્ઠતમ મેળવવાને લાયક છે અને આ કન્સેપ્ટ પ્લાન ઘણાં બધાં સ્તરોની જરૂરિયાતને સંતોષે છે.”

- પેટ ફોર્ટિની (Pat Fortini), રીજીયનલ કાઉન્સિલર, વોર્ડ્સ 7 અને 8; ઉપ-પ્રમુખ, આયોજન અને વિકાસ સમિતિ, સીટી ઓફ બ્રેમ્પટન

“છેલ્લાં પાંચ વર્ષોથી, અમે હેરિટેજ હાઈટ્સનું ભાવિ ઘડવામાં મદદ મેળવવા હિતધારકો, જમીન માલિકો, અને બ્રેમ્પટનવાસીઓ સાથે સહયોગ સાધીને કામ કર્યું છે. આ કન્સેપ્ટ પ્લાનમાં એક દૂરદેશીપણું સમાયેલું છે જે જમીનને એક સંપૂર્ણ અસ્તિત્વ તરીકે વિકસાવે છે અને ભવિષ્યમાં ટકાઉ, ગતિશીલ અને પરવડતા વિકાસના આયોજન માટેની દિશાની ઝાંખી કરાવે છે. અમે આ પ્લાનને સમર્થન આપવામાં ગૌરવ અનુભવીએ છીએ અને ઉત્તર-પશ્ચિમી બ્રેમ્પટનમાં રહેવા યોગ્ય અને જોડાયેલો સમુદાય વસાવવા તરફ આગળ વધવા બધાં પક્ષો સાથે પ્રવૃત્તમય રહેવાનું ચાલુ રાખીશું.”

- માઈકલ પાલેશી (Michael Palleschi), પ્રાદેશિક કાઉન્સિલર, વોર્ડ્સ 2 અને 6, અને ડગ વ્હિલ્લન્સ (Doug Whillans), સીટી કાઉન્સિલર, વોર્ડ્સ 2 અને 6, સીટી ઓફ બ્રેમ્પટન

“બ્રેમ્પટનવાસીઓની જરૂરિયાતો અને વિચારોને પ્રતિબિંબિત કરતા સમુદાયનું આયોજન અને નિર્માણ કરવું એ જ સીટીમાં અમને ચલિત કરે છે, અને હેરિટેજ હાઈટ્સ કન્સેપ્ટ પ્લાન અમને તે વિસ્તારમાં તે કરી શકવામાં એક પગલું આગળ લઈ જાય છે. સીટીના કર્મચારીઓ ઉચ્ચતમ રહેવા યોગ્ય, જોડાયેલો અને સંપૂર્ણ સમુદાય વસાવવાના લક્ષ્ય સાથે હેરિટેજ હાઈટ્સનો આનુષંગિક પ્લાન સુધારવા રહેવાસીઓ, જમીનમાલિકો અને અન્ય સંબંધિત હિતધારકો સાથે પ્રવૃત્તમય રહેવાનું ચાલુ રાખવા આશાવાદી છે.”

- ડેવિડ બાર્રિક (David Barrick), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સીટી ઓફ બ્રેમ્પટન

-30-

મિડિયા સંપર્ક :

મોનિકા ડુગ્ગલ (Monika Duggal)

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રેમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca